



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૧૧/૨૦૧૮ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૭૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૫ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૧૩૯ લીટર દેશી દારૂ, ૧૬ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૧,૦૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૭૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૧૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૨૨૭૬/૧૮

એલીસબ્રીજ : અજયકુમાર હિંમતલાલ દવે (ઉ.વ.૬૬)(રહે.સાર્થક ટાવર રામદેવનગર ચાર રસ્તા સેટેલાઇટ) એ તા.૨૧/૧૧/૧૮ નારોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૧૧/૨૦૧૮ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે સી.એન. વિધ્યાલય નાં ગેટની આગળ રોડ ઉપર થી પત્ની પ્રવિણાબહેનને સ્કુટર પાછળ બેસાડી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા પુરુષ (૩૦ વર્ષના આશરાના) એ પ્રવિણાબહેનના ગળામાંથી સોનાના પેડલ સહિતની ચેઇન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.રાજપુત ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૨૭૭/૧૮

ઘાટલોડીયા : ભાવનાબેન મુકેશભાઈ દેસાઈ (રહે. મંગલમુર્તિ એપાર્ટમેન્ટ નારણપુરા ટેલીફોન એક્ષચેન્જ પાસે ઘાટલોડીયા) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૧૧/૧૮ રાતના ૯/૦૦ થી ૯/૧૫ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- મતાનો અને રોકડ રૂપિયા ૪,૦૦૦/- ચોરી કરી લઇ જઇ તેમજ બારીના કાચ તોડી, ભાવનાબહેનનું એકટીવા સળગાવી નુકસાન કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.આર.પટેલ ચલાવે છે.

રીવરફ્રન્ટ વેસ્ટ : રમેશકુમાર રામાદીન શર્મા (ઉ.વ.૪૪)(રહે.રીવરફ્રન્ટ ફલાવર ગાર્ડન સીક્યુરીટી રૂમમાં, એલીસબ્રિજ) એ રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૧૧/૧૮ સાંજના ૬/૪૫ વાગ્યાના સુમારે એક અજાણ્યા બુલેટ ચાલકે પોતાના કબજાનું બુલેટ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી લાવી, રીવરફ્રન્ટ પશ્ચિમ તરફના રીવરફ્રન્ટ હાઉસ સામે રોડ ઉપર સિક્યુરીટીનું કામ કરતા રમેશભાઈના વેવાઈ પંછીલાલ લાલતાપ્રસાદ શર્મા ને ટકકર મારતાં શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યુ હતું. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.વી.બારીયા ચલાવે છે.

એરપોર્ટ : શૈલેશભાઈ વાઘાજી ઠાકોર (રહે.કોતરપુર ગામ ઠકોરવાસ સરદારનગર) એ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૧૧/૧૮ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે ભદ્રેશ્વર રોડ રવિ પેટ્રોલપંપ ની આગળ રોડ ઉપર એક ઓટોરીક્ષા નંબર જીજી-૦૧-સી.વી ૩૫૬૫ ના અજાણ્યા ચાલકે પુરઝડપે અને બેદરકારીથી રીક્ષા ચલાવતા, રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી ખાઈ જતા, રીક્ષામાં બેસેલ શૈલેષભાઈ ના કાકી કોકીલાબહેન ગુણાજી ઠાકોર (ઉ.વ.૫૦) ના ઓને શરીરે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના ડો.શ્રી એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પ્રજાપતી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૨૭૯/૧૮

વાસણા : હરેશભાઈ રાજુભાઈ સોલંકી (ઉ.વ.૨૦)(રહે. યોગેશ્વરનગર વિભાગ-૨ ગુપ્તાનગર વાસણા) એ અગમ્ય કારણસર તા.૨૧/૧૧/૧૮ સાંજના ૬/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે પંખાના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દીનેશભાઈ કાનજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાઈ શહેર.
પોલીસ કમિશનર વતી.